



NCG-1601270302020202 Seat No. \_\_\_\_\_

**M. A. (Sem. II) (CBCS) (W.E.F. 2016) Examination**

April / May - 2017

**Psychology**

(Advanced Physiological Psychology - II) (New Course)

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70]

- સૂચના : (૧) બધા પ્રશ્નો ફરજિયાત છે.  
(૨) જમણી બાજુના અંકો પ્રશ્નના પૂરા ગુણ દર્શાવે છે.

૧	ગંધના તબક્કાઓ વર્ણવી તેની વિકૃતિઓ સમજાવો.  અથવા	૧૪
૧	ચેતના એટલે શું ? ચેતનાને અસર કરનારાં પરિબળોની ચર્ચા કરો.	૧૪
૨	ખાવા સાથે સંકળાયેલ વેન્ટ્રો મિડિયલ હાયપોથેલેમ્સ (VMH) ઈજ, લક્ષણસમૂહ ૧૪ વર્ણવી તેના અંગેના સિદ્ધાંતો સમજાવો.  અથવા	૧૪
૨	સ્વાદ અને ગંધના શારીરિક આધારો સમજાવો.	૧૪
૩	શિક્ષણ એટલે શું ? શિક્ષણ દરમિયાન થતા શારીરિક ફેરફારો વર્ણવો.  અથવા	૧૪
૩	શિક્ષણમાં હિપોકેમ્પસ અને નાના ભગજની ભૂમિકા વર્ણવો.	૧૪
૪	સ્મૃતિ સાથે સંકળાયેલ ભગજની શારીરિક યંત્રણાઓ સમજાવો.  અથવા	૧૪
૪	દીઘકાલિન અને અલ્યુકાલિન સ્મૃતિ સમજાવી ઓપ્ટીકલ હોલોગ્રામ અટકળની ચર્ચા કરો.	૧૪
૫	નીચેનામાંથી કોઈ પણ બે પર નોંધ લખો :  (૧) REM નિદ્રાનાં કાર્યો (૨) સ્થૂળતા સાથે સંકળાયેલ પરિબળો (૩) માહિતી પ્રકમણમાં લલાટ ખંડની ભૂમિકા (૪) સ્મૃતિભ્રંશ.	૧૪

## ENGLISH VERSION

- Instructions :** (1) All questions are compulsory.  
(2) Figures to the right indicate full marks of the questions.

**1** Describe the stages of sleep and explain its disorders. **14**

**OR**

**1** What is consciousness ? Discuss the factors affecting consciousness. **14**

**2** Describe the Ventro Medial Hypothalamus (VMH) - Lesion syndrome related to eating and explain theories about it. **14**

**OR**

**2** Explain the physiological bases of taste and smell. **14**

**3** What is learning ? Describe the physiological changes occurring during learning. **14**

**OR**

**3** Describe the role of Hippocampus and cerebellum in learning. **14**

**4** Explain the physiological mechanism for memory in the brain. **14**

**OR**

**4** Explain the long term and short term memory and discuss the optical - hologram hypothesis. **14**

**5** Write notes on any two of the following : **14**

- (1) Functions of REM sleep
- (2) Factors related to obesity
- (3) The role of prefrontal lobe in information processing
- (4) Amnesia.

